

અરબી-ગુજરાતી

કુરઆને મજીદ

પારા-૬

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાયોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● [LIKE US ON FACEBOOK](#) ●

[HOME](#) | કુરઆને મજીદ (પારા-૬) -1 | [VISIT US](#)

નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે www.hajinaji.com પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

hajinajitrust@gmail.com

અનુક્રમણિકા

નં.	સૂરાનું નામ	પેજ
૪	સૂર-એ-નિસાઅ (આયત ૧૪૮ થી ૧૭૬)	૪
૫	સૂર-એ-માએદહ (આયત ૧ થી ૮૨)	૩૦

لَا يُحِبُّ اللَّهُ الْجَهْرَ بِالسُّوِّءِ مِنَ الْقَوْلِ إِلَّا مَنْ ظَلِمَ ۗ وَكَانَ

اللَّهُ سَمِيْعًا عَلِيْمًا ﴿١٣٨﴾

(१४८) કોઈ ખુલ્લી રીતે કોઈને માટે બૂરું બોલે તે અલ્લાહ પસંદ કરતો નથી, સિવાય કે જેના ઉપર અન્યાય કરવામાં આવ્યો હોય; અને અલ્લાહ મહાન સાંભળનાર (અને) જાણનાર છે.

إِنْ تَبَدُّوا خَيْرًا أَوْ تَخْفَوْهُ أَوْ تَعْفُوا عَنْ سُوءٍ فَإِنَّ اللَّهَ كَانَ

عَفُوًّا قَدِيْرًا ﴿١٣٩﴾

(१४९) જો તમે કોઈ નેકી જાહેરમાં કરો અથવા છુપી રીતે કરો અથવા કોઈ બૂરાઈથી દરગુજર કરો

તો નિસંશય અલ્લાહ પણ મહાન દરગુજર કરનાર
(અને) સત્તાવાન છે.

إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَنْ يُفَرِّقُوا بَيْنَ
اللَّهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ
وَيُرِيدُونَ أَنْ يُتَّخَذُوا بَيْنَ ذَلِكَ سَبِيلًا ﴿١٥٠﴾

(૧૫૦) બેશક જે લોકો અલ્લાહનો તથા તેના
રસૂલોનો ઇન્કાર કરે છે તથા અલ્લાહ અને તેના
રસૂલો વચ્ચે જુદાઈ પાડવા ઇચ્છે છે અને કહે છે કે
અમે કેટલાક (રસૂલો)ને માનીએ છીએ અને
કેટલાકનો ઇન્કાર કરીએ છીએ, અને તેઓ આ

બંને (કુફ તથા ઇમાન) વચ્ચેનો (બીજો) એક માર્ગ
ગ્રહણ કરવા ઇચ્છે છે:

أُولَئِكَ هُمُ الْكٰفِرُونَ حَقًّا ۖ وَأَعْتَدْنَا لِلْكَٰفِرِينَ عَذَابًا
مُّهِينًا ﴿١٥١﴾

(૧૫૧) તેઓજ ખરેખરા નાસ્તિક છે; અને અમોએ
નાસ્તિકો માટે નામોશી ભર્યો અઝાબ તૈયાર કર્યો
છે.

وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ وَلَمْ يُفَرِّقُوا بَيْنَ أَحَدٍ مِّنْهُمْ
أُولَئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا ﴿١٥٢﴾

(૧૫૨) અને જેઓ અલ્લાહ તથા તેના (સઘળા)
રસૂલો પર (એક સરખી રીતે) ઇમાન લાવ્યા છે

અને તે (રસૂલો)માંથી કોઈની વચ્ચે ભેદભાવ રાખતા નથી તો તે (અલ્લાહ) તેમને તેમનો બદલો નજીકમાં અપાશે; અને અલ્લાહ મહાન ક્ષમા કરનાર (અને) દયા કરનાર છે.

يَسْأَلُكَ أَهْلُ الْكِتَابِ أَنْ تُنزِلَ عَلَيْهِمْ كِتَابًا مِّنَ السَّمَاءِ
 فَقَدْ سَأَلُوا مُوسَىٰ أَكْبَرَ مِنْ ذَلِكَ فَقَالُوا أَرِنَا اللَّهَ جَهْرَةً
 فَأَخَذْتَهُمُ الصَّعِقَةَ يُظْلِمُهُم ۗ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِن بَعْدِ
 مَا جَاءَتْهُمْ الْبَيِّنَاتُ فَعَفَوْنَا عَنِ ذَلِكَ ۗ وَآتَيْنَا مُوسَىٰ
 سُلْطَانًا مُّبِينًا ﴿١٥٣﴾

(૧૫૩) (અય રસૂલ) કિતાબવાળાઓ તારાથી સવાલ કરે છે કે તું આકાશ પરથી તેમના ઉપર

કોઈ કિતાબ ઉતારી લાવે; તો ખરેજ મૂસાને (પણ) તેઓ આ કરતાંય ભારે સવાલ કરી ચૂક્યા છે, અર્થાત તેમણે કહ્યું હતું કે અમને અલ્લાહ પ્રત્યક્ષ દેખાડી દે; જેથી તેમના (આ) ઝુલ્મના કારણે તેમને વીજળી (ના કડાકા) એ પકડી પાડ્યા. વળી તેમની પાસે (તૌહીદના) પ્રત્યક્ષ પુરાવા આવી ગયા પછી પણ તેઓ વાછરડું પૂજવા લાગ્યા, છતાં અમોએ તે (ગુનાહ)થી પણ દરગુજર કરી; અને મૂસાને ખુલ્લી સત્તા અર્પણ કરી.

وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّورَ بِمِيثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا
الْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا فِي السَّبْتِ وَأَخَذْنَا مِنْهُمْ
مِيثَاقًا غَلِيظًا ﴿١٥٣﴾

(१५४) અને તેમનાથી વચન લેવા માટે તેમના
પર તે (સીના) પર્વતને ઊંચો કરી (ધરી રાખ્યો)
અને તેમને અમોચે કહ્યું કે (આ શહેરના)
દરવાજામાંથી સિજદો કરતા દાખલ થાઓ તથા
તેમને (આ પણ) કહ્યું કે "સબ્ત" (શનિવારના
દિવસ)માં અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરો નહિ;
અને (આ વિશે) અમોચે તેમની પાસેથી દ્રઢ વચન
લીધું હતું.

فَبِمَا نَقُضِهِمْ مِيثَاقَهُمْ وَكُفْرِهِمْ بِآيَاتِ اللَّهِ وَقَتْلِهِمُ
 الْأَنْبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌ ۗ بَلْ طَبَعَ اللَّهُ
 عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا ۝

(૧૫૫) પછી તેઓના પોતાના વચન ભંગ
 કરવાના કારણે અને અલ્લાહની આયતોનો ઇન્કાર
 કરવાના કારણે અને નબીઓને વિના કારણે મારી
 નાખવાના કારણે (અમોએ પણ તેમને ફિટકાર્યા);
 વળી તેમના આ બોલો કહેવાના કારણે કે "અમારા
 અંતઃકરણો પર પડદો છે," (જો કે તેમ નથી) બલકે
 અલ્લાહે તેમના નાસ્તિકપણાના કારણે તેમના
 અંતઃકરણો પર મહોર લગાડી દીધી છે, માટે

तेओमांथी घणं थोडाक सिवाय ँमान लावशे नहि.

وَبِكْفُرِهِمْ وَقَوْلِهِمْ عَلَى مَرْيَمَ بُهْتَانًا عَظِيمًا ﴿١٥٦﴾

(१५६) वणी तेमनी नाइरमानीना कारणे अने मरियम उपर गंभीर आण भूकवाना कारणे:

وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّهِ ۗ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَكِنْ شُبِّهَ لَهُمْ ۗ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۗ مَا لَهُمْ بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۗ وَمَا قَتَلُوهُ يَقِينًا ﴿١٥٧﴾

(१५७) अने तेमना आ कहेवाना कारणे के निसंशय अमोअे अल्लाहना रसूल मरियमना पुत्र,

ઇસા, મસીહને મારી નાખ્યો છે, જો કે તેમણે તેને
 ન મારી નાખ્યો અને ન શૂળીએ ચઢાવ્યો પરંતુ
 તેમને તે (ઇસા)ના જેવો લાગ્યો હતો; અને
 નિસંશય જે લોકો આ બાબતમાં મતભેદ કરે છે
 (અને સમજે છે કે ઇસાને શૂળી પર ચઢાવવામાં
 આવ્યો) તો આ બાબતમાં ખરેખર તેઓ મોટી
 શંકામાં (પડ્યા) છે; કેવળ ગુમાનના અનુકરણ
 સિવાય તેમને આ (બાબત)માં કાંઈ જ્ઞાન નથી,
 અને આ તો ખાત્રીપૂર્વક છે કે તેમણે તેને કતલ
 કર્યો નથી:

بَلْ رَفَعَهُ اللَّهُ إِلَيْهِ ۖ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا ﴿١٥٩﴾

(૧૫૮) બલ્કે તેને અલ્લાહે પોતાની તરફ ઊંચકી લીધો છે; અને અલ્લાહ ઝબરદસ્ત હિકમતવાળો છે.

وَإِنْ مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۗ وَيَوْمَ
الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا ۝۱۵۹

(૧૫૯) અને કિતાબવાળાઓમાંથી કોઇપણ એવો નહિ હશે કે જે (મસીહ)ના મરણ પહેલાં તેના પર ઇમાન નહિ લાવે, અને કયામતના દિવસે તે (મસીહ) તેમની વિરુદ્ધ સાક્ષી આપશે.

فَبِظُلْمٍ مِّنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّت
لَهُمْ وَبِصَدِّهِمْ عَنِ سَبِيلِ اللَّهِ كَثِيرًا ۝۱۶۰

(૧૬૦) પછી યહૂદીઓના ઝુલ્મોના કારણે તેમના માટે જે હલાલ વસ્તુઓ હતી તેમાંથી ઘણીએ વસ્તુઓ તેમના માટે અમોએ હરામ કરી નાખી, તેમજ ઘણા લોકોને અલ્લાહના માર્ગથી રોકવાના કારણે પણ:

وَأَخَذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ
بِالْبَاطِلِ ط وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا ﴿١٦﴾

(૧૬૧) અને વ્યાજ ખાવાના કારણે, જો કે તેની તેમને ખચીતજ મનાઇ કરવામાં આવી હતી અને લોકોનો માલ ગેરવાજબી રીતે ખાઇ જવાના કારણે (ઘણી પાક વસ્તુઓ તેમના માટે હરામ કરી

દીધી); અને તેઓમાં જે ઇન્કાર કરનારા છે તેમના માટે અમોએ દુઃખદાયક અઝાબ તૈયાર રાખ્યો છે.

لَكِنِ الرَّسُخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا
أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِنْ قَبْلِكَ وَالْمُقِيمِينَ الصَّلَاةَ
وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ أُولَٰئِكَ
سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا ﴿١٦٢﴾

(૧૬૨) પરંતુ તેઓમાંથી જેઓ ધાર્મિક જ્ઞાનમાં પ્રવીણ છે તથા જેઓ ઇમાન ધરાવનારા છે તેઓ જે કાંઈ તારા પર ઉતારવામાં આવ્યું છે તેને અને જે કાંઈ તારી પહેલાં ઉતારવામાં આવ્યું છે તેને માને છે અને નમાઝ પઢનારા તથા ઝકાત

આપનારા અને અલ્લાહ તથા કયામતના દિવસ
પર ઇમાન લાવનારા છે તેમને જ અમે નઝદીકમાં
ઘણો મોટો બદલો આપનાર છીએ

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِنْ بَعْدِهِ ۗ
وَأَوْحَيْنَا إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ
وَالْأَسْبَاطِ وَعِيسَى وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۗ
وَاتَيْنَا دَاوُدَ زَبُورًا ۗ

(૧૬૩) નિસંશય અમોએ તારા ઉપર એવી રીતે
વહી મોકલી છે કે જેવી રીતે નૂહ પર અને તેના
પછીના નબીઓ પર મોકલી હતી. અને જેવી રીતે
અમોએ ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસ્હાક

તથા યાકૂબ તથા અસ્બાત (ઇસરાઇલના વંશજો)
તથા ઇસા તથા ઐયુબ તથા યુનુસ તથા હારૂન
તથા સુલયમાન પર વહી મોકલી હતી, અને
દાઉદને અમોએ ઝબૂર અર્પણ કરી હતી.

وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِنْ قَبْلُ وَرُسُلًا لَمْ

نَقُصُّهُمْ عَلَيْكَ ۗ وَكَلَّمَ اللَّهُ مُوسَى تَكْلِيمًا ﴿١٣٣﴾

(૧૬૪) અને (બીજા) રસૂલો (ઉપર પણ કે) જેમના
કિસ્સા અમે તને પહેલાં વર્ણવી ચૂક્યા છીએ અને
એવા રસૂલો પણ કે જેમના કિસ્સા અમે તને (હજી)
વર્ણવ્યા નથી. અને મૂસા સાથે અલ્લાહે વાતો
કરવા જોગ વાતો કરી.

رُسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ
 بَعْدَ الرُّسُلِ ۗ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا ﴿١٦٥﴾

(૧૬૫) આ રસૂલો (ને અમોએ) ખુશખબર
 આપનારા તથા ડરાવનારા (બનાવી મોકલ્યા)
 હતા કે જેથી રસૂલો આવ્યા બાદ અલ્લાહના શીરે
 માણસોની કોઈ દલીલ ન રહેવા પામે; અને
 અલ્લાહ ઝબરદસ્ત (અને) હીકમતવાળો છે.

لٰكِنِ اللّٰهُ يَشْهَدُ بِمَاۤ اَنْزَلَ اِلَيْكَ اَنْزَلَهُۥ بِعِلْمِهٖ ۗ وَالْمَلٰٓئِكَةُ
 يَشْهَدُوْنَ ۗ وَكَفٰى بِاللّٰهِ شَهِيدًا ﴿١٦٦﴾

(૧૬૬) (અય રસૂલ! અગર કિતાબવાળા ન માને
 તો પણ) અલ્લાહે તારા પર જે કાંઈ ઉતાર્યું છે

તેની સાક્ષી આપે છે કે તે તેણે પોતાની જાણથી ઉતાર્યું છે, અને ફરિશ્તાઓ પણ (એ વાતની) સાક્ષી આપે છે; અને અલ્લાહની સાક્ષી પૂરતી છે.

إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ قَدْ ضَلُّوا ضَلًّا
بَعِيدًا ﴿١٦٤﴾

(૧૬૭) બેશક જે લોકો ઇમાન નથી લાવ્યા અને જેઓ (બીજા લોકોને) અલ્લાહના માર્ગથી રોકે છે તેઓ ખરેખર ગુમરાહ થઈ ઘણે દૂર ભટકી ગયા છે.

إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا
لِيَهْدِيَهُمْ طَرِيقًا ﴿١٦٨﴾

(૧૬૮) નિસંશય જે લોકોએ નાસ્તિકપણું ધારણ કર્યું તથા ઝુલ્મ પણ કર્યો તેમને અલ્લાહ હરગિઝ માફ કરશે નહિ અને ન તેમને કોઈ માર્ગની હિદાયત કરશે:

إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۗ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ
يَسِيرًا ﴿١٦٩﴾

(૧૬૯) સિવાય કે જહન્નમના માર્ગની કે જેમાં તેઓ સદાને માટે રહેશે; અને અલ્લાહને માટે આ સરળ છે.

يَأْتِيهَا النَّاسُ قَدْ جَاءَ كُمْ الرَّسُولُ بِالْحَقِّ مِنْ رَبِّكُمْ فَأَمِنُوا
 خَيْرًا لَكُمْ ۖ وَإِنْ تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَوَاتِ وَالْأَرْضِ ۗ
 وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا ﴿١٠﴾

(૧૭૦) અય લોકો! ખરેખર (આ) રસૂલ (મોહમ્મદ સ.અ.વ.) તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે સત્ય (ધર્મ) લઇને આવ્યો છે માટે તેના પર ઇમાન લાવો, (એ) તમારા માટે બેહતર છે; પણ જો તમે ઇમાન નહિ લાવો તો નિસંશય આકાશો તથા ઝમીનમાં જે કંઈ છે તે સર્વ અલ્લાહનું છે; અને અલ્લાહ સર્વજ્ઞ (તથા) હિકમતવાળો છે.

يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا
 الْحَقَّ ۗ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ ۗ
 أَلْقَاهَا إِلَى مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ نَفَاثُوا بِاللَّهِ وَرُسُلِهِ ۗ وَلَا
 تَقُولُوا ثَلَاثَةً ۗ إِنْتَهُوا خَيْرًا لَّكُمْ ۗ إِنَّمَا اللَّهُ إِلَهُ وَاحِدٌ ۗ سُبْحَانَ
 أَنْ يَكُونَ لَهُ وَلَدٌ ۗ لَّهُ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَى
 بِاللَّهِ وَكِيلًا ﴿١٤١﴾

(૧૭૧) અથ કિતાબવાળાઓ! તમારા દીનના
 સંબંધમાં અતિશયોક્તિ કરો નહિ અને અલ્લાહના
 સંબંધમાં સત્ય સિવાય બીજું કંઈ પણ કહો નહિ;
 મસીહ, મરિયમનો પુત્ર ઇસા અલ્લાહના એક રસૂલ

સિવાય અન્ય કોઈ નથી અને તે માત્ર તે (અલ્લાહ)નો એક (આજ્ઞાર્થક) બોલ ("કુન") છે, જેને તેણે મરિયમ તરફ ફેંક્યો હતો અને તેની પૈદા કરેલી એક રૂહ (આત્મા) છે; માટે અલ્લાહ તથા તેના રસૂલો પર ઇમાન લાવો, અને "સલાસા" (ત્રણ ખુદા) છે એમ કહો નહિ, (અને એમ કહેવાથી) બચો એ તમારા માટે બેહતર છે; અલ્લાહ તો એક એકલો માઅબૂદ છે; તે એથી પાક છે કે તેને કોઈ પુત્ર હોય; આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે તેનું જ છે; અને અલ્લાહ કાર્યસાધકતા માટે બસ છે.

لَنْ يَسْتَنْكِفَ الْمَسِيحُ أَنْ يَكُونَ عَبْدًا لِلَّهِ وَلَا الْمَلَائِكَةُ
 الْمُقَرَّبُونَ ۖ وَمَنْ يَسْتَنْكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ
 فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا ﴿١٤٦﴾

(૧૭૨) મસીહ અલ્લાહનો બંદો બનવામાં હરગિઝ
 હલકાઇ સમજતો નથી તેમજ નિકટના ફરિશ્તાઓ
 પણ; અને જે કોઇ તે (એક અલ્લાહ)ની ઇબાદત
 કરવાને હલકાઇ ગણે છે અને અહંકાર કરે છે તો
 નજીકમાં જ તે તેમને પોતાની પાસે ભેગા કરી
 લેશે.

فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ
 وَيَزِيدُهُمْ مِّنْ فَضْلِهِ ۗ وَأَمَّا الَّذِينَ اسْتَنْكَفُوا وَاسْتَكْبَرُوا

فَيَعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا ۖ وَلَا يَجِدُونَ لَهُمْ مِّنْ دُونِ اللَّهِ وَلِيًّا
وَلَا نَصِيرًا ﴿١٤٣﴾

(૧૭૩) પછી જે લોકો ઇમાન લાવ્યા છે તથા સત્કાર્યો કરે છે તેમને તે તેના બદલા પૂરે પૂરા આપશે, વળી પોતાની કૃપાથી તેમને કાંઈ વધારી પણ આપશે; અને જે લોકો (અલ્લાહના બંદા હોવામાં) હલકાઈ ગણે છે અને અભિમાન કરે છે તો તે તેમને દુઃખદાયક અઝાબ આપશે. અને અલ્લાહ સિવાય તેઓ અન્ય કોઈને પોતાનો મિત્ર કે મદદગાર જોશે નહિ.

يَأْتِيهَا النَّاسُ قَدْ جَاءَ كُمْ بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنْزَلْنَا إِلَيْكُمْ
نُورًا مُّبِينًا ﴿١٤٣﴾

(૧૭૪) અથ લોકો! બેશક તમારી પાસે તમારા
પરવરદિગાર તરફથી (સત્ય ધર્મની ખુલ્લી)
દલીલ આવી ચૂકી છે અને અમોએ તમારા તરફ
સત્ય ખુલ્લું કરી દેખાડી દેનાર નુર (કુરઆન)
ઉતાર્યું છે.

فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ
مِّنْهُ وَفَضْلٍ ۗ وَيَهْدِيهِمْ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ ﴿١٤٥﴾

(૧૭૫) પછી જે લોકો અલ્લાહ પર ઇમાન લાવ્યા
તથા તે (કુરઆન)ને દ્રઢતાપૂર્વક વળગી રહ્યા,

તેમને નઝદીકમાં તે પોતાની દયા તથા કૃપામાં
 દાખલ કરશે અને તેમને પોતાની તરફનો સીધો
 માર્ગ દેખાડશે.

يَسْتَفْتُونَكَ ۗ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۗ إِنَّ أَمْرُؤًا هَلَكَ
 لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۗ وَهُوَ يَرِيهَا إِنْ
 لَّمْ يَكُنْ لَهَا وَلَدٌ ۗ فَإِنْ كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الشُّلْثَنِ ۗ وَإِنْ
 تَرَكَ ۗ وَإِنْ كَانُوا إِخْوَةً رِجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ
 الْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّهُ لَكُمْ أَنْ تَضِلُّوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ
 عَلِيمٌ ﴿٤٦﴾

(૧૭૬) (અથ રસૂલ !) તેઓ તારી પાસે ફત્વો માગે છે; તું કહે કે અલ્લાહ તમને "કલાલહ"ના સંબંધમાં ફત્વો આપે છે; કે જો કોઈ પુરૂષ અવલાદ (અથવા માં-બાપ) વિના મરણ પામે અને તેની (માત્ર) એક બહેન હોય તો તેને જે તે મૂકી જાય તેનો અર્ધો ભાગ મળશે, અને એવીજ રીતે તે શખ્સ તે બહેનનો વારસ થશે જો તેણીને અવલાદ (અથવા માં-બાપ) નહિ હોય; પણ જો બે બહેનો હોય તો બંનેને જે તે મૂકી જાય તેનો બે તૃતિયાંશ ભાગ મળશે; અને જો ભાઈ બહેનો હોય તો પુરૂષને બે સ્ત્રીઓની બરાબર મળશે; અલ્લાહ તમારા માટે (આ) એ કારણે સ્પષ્ટ કરીને વર્ણવે છે કે તમે

ભટકી જાઓ નહિ; અને અલ્લાહ દરેક વસ્તુથી
ખબરદાર છે.

सूरये माये ६६ / سورة المائدة

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

अल्लाहना नामथी (शरु कुरुं छु) जे धरौ महेरबान
(कृपाणु), बहुर रहेम (दया) वाणो छे.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ ۖ أُحِلَّتْ لَكُمْ بَهِيمَةُ
الْأَنْعَامِ إِلَّا مَا يُتْلَى عَلَيْكُمْ غَيْرَ مُحِلِّي الصَّيْدِ وَأَنْتُمْ
حُرْمٌ ۗ إِنَّ اللَّهَ يَحْكُمُ مَا يُرِيدُ ①

(१) अथ धमान लावनाराओ! (आपेला) वायदा
पूरा करो, योपगा जानवरो तमारा माटे हलाल
करवामां आव्या छे सिवाय के जे (नी मनाध)
तमने वांची संभलाववामां आवी छे; परा ज्यारे

તમે એહરામની (હજના વસ્ત્રો પરિધાન કરેલી) હાલતમાં હો તો શિકાર (કરવા)ને હલાલ સમજશો નહિ; બેશક અલ્લાહ જેવો યાહે છે તેવો હુકમ આપે છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَحِلُّوا شَعَائِرَ اللَّهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا
 الْهَدْيَ وَلَا الْقَلَائِدَ وَلَا أُمِّينَ الْبَيْتِ الْحَرَامِ يَبْتَغُونَ
 فَضْلًا مِّن رَّبِّهِمْ وَرِضْوَانًا وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا وَلَا
 يَجْرِمَنَّكُمْ شَنَا نُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن
 تَعْتَدُوا م وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى ۖ وَلَا تَعَاوَنُوا عَلَى
 الْإِثْمِ وَالْعُدْوَانِ ۖ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ ⑤

(૨) અય ઇમાન લાવનારાઓ! અલ્લાહની (નક્કી કરેલી) નિશાનીઓની અવગણના ન કરો અને ન હુરમતવાળા મહીનાની અને ન ભેટ ધરેલી કુરબાનીની અને ન ચટાપટાવાળી (ખાસ પ્રકારના નિશાન કરેલી) કુરબાનીની અને ન તે લોકોની કે જેઓ પોતાના પરવરદિગારની મહેરબાની તથા તેની ખુશી મેળવવાની ઇચ્છાથી તે હુરમતવાળા ઘર તરફ જતા હોય; અને જ્યારે તમે એહરામ ઉતારી નાખો ત્યારે (ભલે) શિકાર કરો; અને કોઈ કોમે તમને મસ્જિદુલ હરામથી રોક્યા તેથી તે (કોમ) પ્રતિ (ઉત્પન્ન થયેલો) દ્વેષભાવ તમને ઉશ્કેરીને એ વાતનું કારણ ન બને કે તમે

અત્યાચારી બની બેસો; અને નેકી તથા પરહેઝગારીમાં એક બીજાને સહાય કરો, અને ગુનાહ અને શત્રુતામાં એકમેકની સહાય કરો નહિ અને અલ્લાહથી ડરો; બેશક અલ્લાહ સખ્ત અઝાબ આપનાર છે.

حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالْدَّمُ وَلَحْمُ الْخِنْزِيرِ وَمَا أُهْلَ لِغَيْرِ
 اللَّهِ بِهِ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيحَةُ وَمَا
 أَكَلَ السَّبُعُ إِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُبِحَ عَلَى النُّصُبِ وَأَنْ
 تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ ط ذَلِكَمُ فِسْقٌ ط الْيَوْمَ يَبْسُ الَّذِينَ
 كَفَرُوا مِنْ دِينِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ط الْيَوْمَ أَكْمَلْتُ

لَكُمْ دِينَكُمْ وَأُمَّتٌ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيْتُ لَكُمْ
 الْإِسْلَامَ دِينًا فَمَنِ اضْطُرَّ فِي مَخْصَصَةٍ غَيْرِ مُتَجَانِفٍ
 لِإِثْمٍ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ ﴿٣﴾

(3) (અય લોકો !) તમારા પર મુરદાર તથા લોહી તથા સુવ્વરનું માંસ હરામ કરવામાં આવ્યું છે, અને તે જાનવર કે જેના (ઝબ્હ કરવા) ઉપર અલ્લાહ સિવાય બીજા કોઈનું નામ લેવામાં આવ્યું હોય, અને જે ગરદન મચડીને મારી નાખવામાં આવ્યું હોય અને જે મારી મારીને મારી નાખવામાં આવ્યું હોય, અને જે ઊંચાણ પરથી પડી મરણ પામ્યું હોય અને જે શીંગડા (લાગવા)થી મરી ગયું હોય,

અને જેને હિંસક પ્રાણીઓએ ફાડી ખાધું હોય
સિવાય કે જેને તમોએ (જીવ બાકી હોવાની
હાલતમાં) ઝબ્હ કર્યું હોય, અને જે (દેવ દેવીઓની)
વેદી પર ઝબ્હ કરવામાં આવ્યું હોય અને એ પણ
કે જે શરત લગાવીને બાણો વડે ભાગ પાડી
લેવામાં આવ્યું હોય; એ સર્વે આજ્ઞા ભંગ (કરવા
સમાન) છે. (અથ મુસલમાનો!) આજના દિવસે
નાસ્તિકો તમારા દીનથી નિરાશ થઈ ગયા છે માટે
તમે તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરો.
આજે મેં તમારા માટે તમારો દીન પરીપૂર્ણ કરી
દીધો છે અને મારી નેઅમત તમારા પર સંપૂર્ણ
કરી દીધી છે અને દીને ઇસ્લામ તમારા માટે

પસંદ કરી લીધો છે; પણ જે કોઈ ભૂખના કારણે
 વ્યાકુળ બનીને (છતાં) ગુનાહનો હેતુ ન રાખતાં
 (મજકુર હરામ વસ્તુઓનો ઉપયોગ કરે) તો બેશક
 અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.

يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمْ الطَّيِّبَاتُ ۗ وَمَا
 عَلَّمْتُمْ مِنَ الْجَوَارِحِ مُكَلَّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ
 اللَّهُ فَكُلُوا مِمَّا أَمْسَكَنَّ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهِ
 وَاتَّقُوا اللَّهَ ۗ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ ۝

(૪) (અથ રસૂલ!) લોકો તને પૂછે છે કે તેમના
 માટે શું શું હલાલ કરવામાં આવ્યું છે? તું કહે કે
 તમારા માટે સઘળી પાક વસ્તુઓ હલાલ કરવામાં

આવી છે, અને તમોએ શિકાર માટે કેળવેલા જાનવરોએ પકડેલા પ્રાણીઓ પણ (હલાલ છે કે જે જાનવરોને તમોએ) અલ્લાહના જણાવ્યા મુજબ કેળવ્યા હોય, માટે તેમણે પકડેલા પ્રાણીઓ પર અલ્લાહનું નામ લઈ (ઝબ્હ કરી) તે ખાઓ; અને અલ્લાહથી ડરતા રહો; નિસંશય અલ્લાહ ઘણો ઝડપી હિસાબ લેનાર છે.

الْيَوْمَ أُحِلَّ لَكُمْ الطَّيِّبُ ط وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ
 حِلٌّ لَكُمْ ۖ وَطَعَامُكُمْ حِلٌّ لَهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ
 الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ
 قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسْفِحِينَ

وَلَا تُتَّخِذِي أَخْدَانٍ ۖ وَمَنْ يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ
عَمَلُهُ ۖ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَسِرِينَ ۝

(૫) આજના દિવસે તમારા પર સઘળી પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે; અને તે લોકોનો ખોરાક પણ કે જેમને કિતાબ આપવામાં આવી છે તે તમારા માટે હલાલ છે, અને તમારો ખોરાક તેમના માટે હલાલ છે; અને શિયળવંતી મોઅમીન સ્ત્રીઓ અને જેમને તમારી અગાઉ કિતાબ આપવામાં આવી હતી તે માંહેની શિયળવંતી સ્ત્રીઓ પણ (હલાલ છે), એ શરતે કે તમોએ તેમની મહેર આપી દીધી હોય, નિકાહમાં લેવાના હેતુથી, નહિ કે વ્યભિચાર કરવા અથવા

છુપો સંબંધ ધરાવવાના હેતુથી; અને જે કોઈ ઇમાનનો ઇન્કાર કરનાર હશે તેના સઘળા કર્મો એળે જશે, અને તે પરલોકમાં હાનિ ભોગવનારાઓ માંહેનો થશે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ
 وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى
 الْكَعْبَيْنِ^ط وَإِنْ كُنْتُمْ جُنُبًا فَاطَّهَّرُوا^ط وَإِنْ كُنْتُمْ مَرَضَى
 أَوْ عَلَى سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنْكُم مِّنَ الْغَايِبِ أَوْ لَبَسْتُمُ
 النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا
 بِرُءُوسِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ^ط مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُمْ مِنْ

حَرَجٌ وَلَكِنْ يُرِيدُ لِيُطَهَّرَكُمْ وَلِيُتَمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ
تَشْكُرُونَ ﴿٦﴾

(5) અથ ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે નમાઝ માટે તૈયાર થઈ જાઓ ત્યારે તમારા મોંઢાં ધોઈ નાખો અને તમારા હાથ કોણીઓ સુધી (ધુઓ), અને તમારા માથાનો તથા ઘુંટી સુધી (બન્ને) પગનો મસાહ કરી લો, અને જો તમે (નાપાકીની હાલતમાં) સ્નાન કર્યા વિનાના હો તો (પ્રથમ) સ્નાન કરી લો; અને અગર તમે માંદા હો અથવા મુસાફરીમાં હો અથવા તમારામાંથી કોઈ પાચખાનામાંથી આવ્યો હોય અથવા સ્ત્રીસંગ કર્યા હોય પછી જો તમને પાણી ન મળે તો પાક માટી

વડે તયમ્મુમ કરી લો અને તે વડે તમારા મોઢા તથા તમારા બેઉ હાથનો મસાહ કરી લો; અલ્લાહ તમને અગવડતામાં મુકવા નથી યાહતો, બલ્કે તે તમને પવિત્ર કરવા તથા તમારા પર પોતાની નેઅમત પૂર્ણ કરવા યાહે છે કે જેથી તમે આભારી બનો.

وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الّذِي وَاثَقَكُمْ بِهِ ۗ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۗ وَاتَّقُوا اللَّهَ ۗ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ④

(૭) અને અલ્લાહની જે નેઅમતો તમને (અર્પણ) થઈ છે તેની યાદ કરતા રહો અને તેનું તે વચન

જે તેણે તમારી સાથે પાકું કરી લીધું છે (તે વખતે)
જ્યારે તમોએ આ કહી દીધું હતું કે અમોએ
સાંભળ્યું અને કબુલ કર્યું (એ પણ યાદ કરતા રહો),
અને અલ્લાહથી ડરતા રહો; બેશક અલ્લાહ
અંતઃકરણની વાતોથી સંપૂર્ણ માહિતગાર છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوْمِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ وَلَا
يَجْرِمَنَّكُمْ شَنَا نُ قَوْمٍ عَلَىٰ آلا تَعْدِلُوا ط اِعْدِلُوا قف هُوَ أَقْرَبُ
لِلتَّقْوَىٰ وَاتَّقُوا اللَّهَ ط إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ۝

(૮) અય ઇમાન લાવનારાઓ! અલ્લાહના માટે
ન્યાયસર સાક્ષી બનવાને તૈયાર રહો, અને
ખબરદાર! કોઈ કોમની (ગમે તેવી) સખ્ત

દુશ્મનાઇ પણ તમને એ વાત ઉપર ન ઉશ્કેરે કે તમે ન્યાય ન કરો; ન્યાયથી જ વર્તો, તે પરહેઝગારીની વધુ પાસે છે, અને અલ્લાહથી ડરતા રહો; બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સંપૂર્ણ માહિતગાર છે.

وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ

عَظِيمٌ ⑨

(૯) જેઓ ઇમાન લાવ્યા છે અને સત્કાર્યો કરે છે તેમને અલ્લાહે વાચદો કર્યો છે કે તેમના માટે ક્ષમા તથા ઘણો મોટો બદલો છે.

وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ⑩

(૧૦) અને જે લોકો ઇન્કાર કરનારા છે અને અમારી આયતોને જૂઠલાવે છે તેઓ જહન્નમ વાસીઓ છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ هُمْ قَوْمٌ
أَنْ يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنْكُمْ ۗ وَاتَّقُوا
اللَّهَ ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١١

(૧૧) અય ઇમાન લાવનારાઓ! તમારા પરની અલ્લાહની તે બક્ષીશ યાદ કરો કે જ્યારે એક કોમે પોતાના હાથો તમારા તરફ (ઝુલ્મ કરવાના હેતુથી) લંબાવવાનો ઇરાદો કર્યો હતો પણ તેણે તમારાથી તેમના હાથો રોકી દીધા હતા, અને

અલ્લાહથી ડરતા રહો; અને મોઅમીનોએ અલ્લાહ
જ ઉપર ભરોસો રાખવો જોઈએ.

وَلَقَدْ أَخَذَ اللَّهُ مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ ۖ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَيْ
عَشَرَ نَقِيبًا ۖ وَقَالَ اللَّهُ إِنِّي مَعَكُمْ ۗ لَئِنْ أَقَمْتُمُ الصَّلَاةَ
وَاتَيْتُمُ الزَّكَاةَ وَآمَنْتُمْ بِرُسُلِي وَعَزَّرْتُمُوهُمْ وَأَقْرَضْتُمُ
اللَّهَ قَرْضًا حَسَنًا لَأُكَفِّرَنَّ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَلَأُدْخِلَنَّكُمْ
جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۗ فَمَنْ كَفَرَ بَعْدَ ذَلِكَ مِنْكُمْ
فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ﴿١٢﴾

(૧૨) અને ખરેખર અલ્લાહે બની ઇસરાઇલ
પાસેથી વચન લીધું હતું અને તેમનામાં અમોએ

બાર સરદારો ઉભા કર્યા હતા; અને (તેમને) અલ્લાહે ફરમાવ્યું હતું કે બેશક હું તમારી સાથે છું; અગર તમે નમાઝ પઢતા રહેશો તથા ઝકાત આપતા રહેશો તથા મારા રસૂલો પર ઇમાન લાવશો તથા તેમની મદદ કરશો અને અલ્લાહને કહે હસના આપતા રહેશો તો ખરેખર હું તમારી બૂરાઇઓથી દરગુઝર કરીશ અને તમને જરૂર જન્નતોમાં દાખલ કરીશ, જેની હેઠળ થઇને નદીઓ વહેતી ફરે છે, છતાં ત્યારબાદ તમારામાંથી જે કોઇ (આ આજ્ઞાઓની) અવગણના કરશે તો તે ખરેખર સીધા માર્ગથી ભટકી જશે.

فَبِمَا نَقَضْتُمْ مِيثَاقَهُمْ لَعْنَتُهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَاسِيَةً
يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهَا وَتَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ
وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَى خَائِنَةٍ مِّنْهُمْ إِلَّا قَلِيلًا مِّنْهُمْ فَاعْفُ
عَنْهُمْ وَاصْفَحْ ۗ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ ﴿١٣﴾

(૧૩) પછી તેમના વચન ભંગ કરવાના કારણે અમોએ તેમના પર ફિટકાર કર્યો અને તેમના અંતઃકરણોને સખત કરી દીધા, કારણ કે તેઓ (અમારા) શબ્દોને તેમના સ્થાનેથી બદલી નાખતા હતા અને જે વસ્તુની તેમને નસીહત કરવામાં આવી હતી તેનો કેટલોક ભાગ ભૂલી ગયા હતા, અને તેઓ માંના થોડાકો સિવાય બીજા

સઘળાઓની કાંઈ નહિ તો એકાદ પણ વિશ્વાસઘાતની ખબર તો તને હંમેશા મળતી જ રહેશે. છતાં તું તેમને માફ કર અને દરગુઝર કર; બેશક અલ્લાહ ઉપકાર કરનારાને દોસ્ત રાખે છે.

وَمِنَ الَّذِينَ قَالُوا إِنَّا نَصْرَىٰ أَخَذْنَا مِيثَاقَهُمْ فَنَسُوا حَظًّا
مِمَّا ذُكِّرُوا بِهِ ۖ فَأَغْرَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَى يَوْمِ

الْقِيَامَةِ ۗ وَسَوْفَ يُنَبِّئُهُمُ اللَّهُ بِمَا كَانُوا يَصْنَعُونَ ﴿١٣﴾

(૧૪) અને તે લોકોમાંથી જેઓ એમ કહે છે કે અમે નસારા (ખ્રિસ્તી) છીએ તો અમે તેમનું વચન લઈ લીધું હતું, પણ તેમને જે કાંઈ ઉપદેશ કરવામાં આવ્યો હતો તેનો એક (મોટો) ભાગ (રિસાલતે

મોહમ્મદી) વિસરી ગયા છે; આથી અમોએ તેમની વચ્ચે કયામતના દિવસ સુધી શત્રુતા અને દ્વેષ ઉભા કરી દીધા છે; અને તેઓ શું શું (ચાલાકી) કરતા હતા તે અલ્લાહ તેમને જણાવી દેશે.

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِمَّا كُنْتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُوا عَنْ كَثِيرٍ ۖ قَدْ جَاءَكُمْ مِنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُبِينٌ ﴿١٥﴾

(૧૫) અય કિતાબવાળાઓ! ખરેજ અમારો રસૂલ તમારી પાસે આવ્યો છે, કિતાબમાંથી જે તમે સંતાડ્યા કરતા હતા તેમાંથી તે તમારા પર ઘણું ખરું જાહેર કરી દે છે અને ઘણા ખરાથી (તમારી

લાગણી ન દુખાય એ માટે) દરગુઝર કરે છે;
ખચીતજ તમારી પાસે અલ્લાહ તરફથી નુર અને
સ્પષ્ટ કિતાબ આવી ચૂકી છે;

يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ
الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ ①٦

(૧૬) જે દ્વારા અલ્લાહ તે લોકોને કે જેઓ તેની
મરજીનું અનુકરણ કરે છે તેમને સલામતીનો માર્ગ
દેખાડે છે તથા તેમને (કુફ્રના) અંધકારમાંથી કાઢી
પોતાના હુકમથી (ઇમાનની) રોશની તરફ લઇ
આવે છે અને તેમને સીધા માર્ગ સુધી પહોંચાડી દે
છે.

لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ط قُلْ
 فَمَنْ يَمْلِكُ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ أَنْ يُهْلِكَ الْمَسِيحَ ابْنَ
 مَرْيَمَ وَأُمَّهُ وَمَنْ فِي الْأَرْضِ جَمِيعًا ط وَ لِلَّهِ مُلْكُ السَّمَوَاتِ
 وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ط يَخْلُقُ مَا يَشَاءُ ط وَاللَّهُ عَلَى كُلِّ شَيْءٍ
 قَدِيرٌ ﴿١٤﴾

(૧૭) ખરેખર ! જેઓ કહે છે કે મરિયમનો પુત્ર મસીહ એજ અલ્લાહ છે. તેઓએ નાસ્તિકપણું કર્યું; તું કહે કે જો અલ્લાહ મરિયમના પુત્ર મસીહ તથા તેની માને તથા ઝમીનમાં જે જે (કાંઈ) છે તે સર્વનો નાશ કરવાનો નિશ્ચય કરે તો તેને તેમ કરતાં કોણ રોકી શકનાર છે? અને આકાશો તથા

અમીનમાં તથા જે કાંઈ તેમની વચ્ચે છે તેનો અધિકાર અલ્લાહને જ છે; જે ચાહે છે તે પૈદા કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે.

وَقَالَتِ الْيَهُودُ وَالنَّصْرَىٰ نَحْنُ أَبْنَاءُ اللَّهِ وَأَحِبَّاؤُهُ ۗ قُلْ فَلِمَ يُعَذِّبُكُمْ بِذُنُوبِكُمْ ۗ بَلْ أَنْتُمْ بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۗ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَلِلَّهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا ۗ وَإِلَيْهِ الْمَصِيرُ ﴿١٨﴾

(૧૮) અને યહૂદીઓ તથા નસારાઓ કહે છે કે અમે અલ્લાહના પુત્રો તથા તેના પ્યારા છીએ; તું કહે કે (જો એમજ છે તો) પછી તે તમને તમારા

ગુનાહો બદલ કેમ શિક્ષા કરે છે? (તેમ નથી) બલ્કે તમે પણ તેના પૈદા કરેલા (ઇન્સાનો) માંના ઇન્સાન છો; તે જેને યાહે છે તેને માફ કરે છે અને જેને યાહે છે સજા કરે છે; અને સઘળાં આકાશો તથા ઝમીન અને તેમની વચ્ચે જે કાંઈ છે તેની સત્તા અલ્લાહને જ છે. અને (સર્વનું) છેવટનું પાછું ફરવું તેની જ તરફ થશે.

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَى فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَنْ تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ فَقَدْ جَاءَكُمْ بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿١٩﴾

(૧૯) અય કિતાબવાળાઓ ! બેશક અમારો રસૂલ (અમારી આજ્ઞાઓ) તમને સ્પષ્ટ કરીને વર્ણવી સમજાવવા માટે તમારી પાસે પયગમ્બરોનું આવવું ઘણો વખત મુલતવી રહ્યા પછી આવ્યો છે, એ માટે કે તમે એમ ન કહો કે અમારી પાસે તો ખુશખબર આપનાર તથા ડરાવનાર કોઈજ આવ્યો ન હતો. માટે હવે તો તમારી પાસે ખુશખબર આપનાર તથા ડરાવનાર ખરેજ આવી ચૂક્યો છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે.

وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ يُقَوْمِ ادْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ
 جَعَلَ فِيكُمْ أَنْبِيَاءَ وَجَعَلَكُمْ مُلُوكًا ۖ وَآتَاكُمْ مَا لَمْ يُؤْتِ
 أَحَدًا مِّنَ الْعَالَمِينَ ﴿٢٠﴾

(૨૦) અને (તે સમયને યાદ કરો) જ્યારે મૂસાએ
 પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ! અલ્લાહે
 તમારા પર કરેલી તે નેઅમતને યાદ કરો કે
 જ્યારે તમારામાં નબીઓ બનાવ્યા તથા તમને
 બાદશાહ બનાવ્યા અને તમને તે સઘળું આપ્યું કે
 જે દુનિયામાંના કોઈને પણ આપ્યું ન હતું.

يُقَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ وَلَا
 تَرْتَدُّوا عَلَى أَدْبَارِكُمْ فَتَنْقَلِبُوا خَاسِرِينَ ﴿٢١﴾

(૨૧) અય મારી કોમ! તમે આ પવિત્ર ભૂમિમાં દાખલ થાઓ જે અલ્લાહે તમારા માટે લખી દીધી છે અને (શત્રુઓના મુકાબલા વખતે) પીઠ તરફ પાછા ફરો નહિ, નહિ તો હાનિ ભોગવનારા થઇ જશો.

قَالُوا يٰمُوسَىٰ اِنَّ فِيهَا قَوْمًا جَبّٰرِيْنَ ؕ وَاِنَّا لَنْ نَدْخُلَهَا حَتّٰى

يَخْرُجُوۡا مِنْهَا ۗ فَاِنۡ يَخْرُجُوۡا مِنْهَا فَاِنَّا دٰخِلُوۡنَ ۝۴۲

(૨૨) તેમણે કહ્યું કે અય મૂસા ! નિસંશય એ (ભૂમિ)માં તો બળવાન લોકોની એક કોમ છે, અને જ્યાં સુધી તેમાંથી તેઓ નીકળી નહિ જાય ત્યાં સુધી અમે હરગિઝ (તેમાં) દાખલ થઇશું નહિ; પણ

(હા) જો તેઓ તેમાંથી નીકળી જશે તો અમે જરૂર દાખલ થઈશું.

قَالَ رَجُلٌ مِّنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمَا ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ ۖ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غُلَبُونَ ۗ وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنْتُمْ مُّؤْمِنِينَ ﴿٣٣﴾

(૨૩) તેઓ માંના બે શખ્સોએ કે જેઓ (અલ્લાહથી) ડરતા હતા અને જેમને અલ્લાહે નેઅમત અર્પણ કરી હતી કહ્યું કે દરવાજામાંથી તેમના પર ઘસી જાઓ, કારણ કે જ્યારે તમે તે (પવિત્ર ભૂમિ)માં દાખલ થશો તો નિસંશય તમેજ

વિજયી નિવડશો, અને અગર તમે મોઅમીન હો
તો અલ્લાહ ઉપરજ ભરોસો રાખો.

قَالُوا يُمُوسَى إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا فَاذْهَبْ
أَنْتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هُنَا قَاعِدُونَ ﴿٢٤﴾

(૨૪) (ફરીથી) તેમણે કહ્યું કે અય મૂસા ! જ્યાં
સુધી તેઓ અંદર છે અમે તો અંદર નહિજ જઇએ;
જેથી તું અને તારો પરવરદિગાર જાઓ અને બંને
(જણ તેમની સાથે) લડો; અમે તો અહીંજ બેસી
રહીશું.

قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي فَافْرِقْ بَيْنَنَا وَبَيْنَ
الْقَوْمِ الْفَاسِقِينَ ﴿٢٥﴾

(૨૫) (મૂસાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! હું કેવળ મારી જાત (પોતા)નો તથા મારા ભાઈનો અધિકાર ધરાવું છે; માટે તું અમને તે નાફરમાન લોકોથી જુદા પાડી દે (કે જેથી તેમના પાપના છાંટા અમને ન ઉડે).

قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ أَرْبَعِينَ سَنَةً ۖ يَتِيهُونَ فِي
الْأَرْضِ ۗ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ ﴿٣٦﴾

(૨૬) (અલ્લાહે) ફરમાવ્યું કે તેમના માથે નિસંશય તે ભૂમિ ચાલીસ વર્ષ સુધી હરામ કરી દેવામાં આવશે, (જેથી) તેઓ પૃથ્વી પર (માર્યાં માર્યાં) ભટક્યા કરશે; માટે તું તે નાફરમાન લોકોની (અવદશા) પર ખેદ કરીશ નહિ

وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ ۖ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقْبِلَ مِنْ
 أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ ۖ قَالَ لَأَقْتُلَنَّكَ ۗ قَالَ إِيْمًا
 يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ ﴿٣٧﴾

(૨૭) અને (અથ રસૂલ!) તું તેમને આદમના બંને
 બેટાઓની ખરી હકીકત વાંચી સંભળાવ કે જ્યારે
 તેમણે (પોત પોતાની) કુરબાની રજૂ કરી ત્યારે તે
 બંનેમાંથી એક (હાબીલ)ની તો કબૂલ થઈ અને
 બીજા (કાબીલ)ની કબૂલ થઈ નહિ; જેથી તેણે
 (ઈર્ષાથી) કહ્યું કે હું જરૂર તને મારી નાખીશ;
 (હાબીલે) કહ્યું કે અલ્લાહ તો પરહેઝગારોની જ
 કુરબાની કબૂલ કરે છે.

لَئِنْ بَسَطْتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسٍ يَدِي إِلَيْكَ
لِأَقْتُلَكَ ۗ إِنَّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ ﴿٢٨﴾

(૨૮) અગર તું તારો હાથ મને મારી નાખવાના ઇરાદાથી મારા તરફ લંબાવશે તો પણ હું મારો હાથ તને મારી નાખવાના હેતુથી તારી તરફ લંબાવનાર નથી; નિસંશય હું તો સઘળી દુનિયાઓના પરવરદિગારથી ડરું છું.

إِنِّي أُرِيدُ أَنْ تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۗ
وَذَلِكَ جَزَاءُ الظَّالِمِينَ ﴿٢٩﴾

(૨૯) નિસંશય હું તો એજ યાહું છું કે મારો અને તારો (યાને આપણા બંનેનો) ગુનોહ તું (એકલો) જ

ભોગવે કે જેથી તું જહન્નમવાસીઓ માંહેનો થઈ જાય, અને ઝુલમગારોનો બદલો એજ છે.

فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخٰسِرِيْنَ ﴿٣٠﴾

(30) પછી તેના અંતઃકરણે તેના માટે તેના ભાઈનું ખૂન કરવાનું કાર્ય સહેલું કરી દીધું જેથી તેણે તેને મારી નાખ્યો એટલે તે હાનિ ભોગવનારાઓ માંહેનો થઈ ગયો.

فَبَعَثَ اللّٰهُ غُرَابًا يَّبْحَثُ فِي الْاَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ اَخِيهِ ط

قَالَ يُوَيْلَتِي اَعْجَزْتُ اَنْ اَكُوْنَ مِثْلَ هٰذَا

الْغُرَابِ فَاُوَارِي سَوْءَةَ اَخِي ؕ فَاَصْبَحَ مِنَ النَّٰدِمِيْنَ ﴿٣١﴾

(૩૧) પછી અલ્લાહે એક કાગડાને મોકલ્યો જે ભૂમિ ખોતરવા લાગ્યો એ માટે કે તેને દેખાડે કે તે પોતાના ભાઇની લાશને કેવી રીતે છુપાવે. (એ જોઇ) (કાબીલ) કહેવા લાગ્યો હાથ ખરાબી મારી! શું હું આ કાગડા જેવો થવાને પણ અશક્ત છું કે મારા ભાઇની લાશને સંતાડી પણ ન શકું! સારાંશ કે તે પસ્તાવો કરનારાઓ માંહેનો થઇ ગયો

مِنْ أَجْلِ ذَٰلِكَ ۖ كَتَبْنَا عَلَىٰ يَتِيمَ إِسْرَآءِيلَ أَنَّهُ مَن قَتَلَ
 نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ
 جَمِيعًا ۚ وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۗ وَلَقَدْ

جَاءَهُمْ رَسُولُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُمْ بَعَدَ ذَلِكَ
فِي الْأَرْضِ لَمُسْرِفُونَ ﴿٣٢﴾

(32) આ કારણે અમોએ બની ઇસરાઇલ પર લાઝિમ કરી દીધું કે જે કોઇ કોઇ જીવને બીજા જીવના (ખૂન કરવાના) બદલા સિવાય અથવા ભૂમિમાં ફસાદ કર્યા સિવાય મારી નાખે તો જાણે તેણે સઘળા માણસોને મારી નાખ્યા; અને જેણે એક જીવને જીવતદાન દીધું તો તેણે જાણે સઘળા માણસોને જીવતદાન આપ્યું; અને ખરેખર અમારા રસૂલો તેમની પાસે પ્રત્યક્ષ નિશાનીઓ લઇને આવ્યા હતા, પછી તે બાદ પણ તેઓ માંના ઘણા ખરા ભૂમિમાં અમર્યાદિત પણે વર્તતા રહે છે.

اِمَّا جَزَاۗءُ الَّذِيۡنَ يُحَارِبُوۡنَ اللّٰهَ وَرَسُوۡلَهٗ وَيَسْعَوۡنَ فِى الْاَرْضِ
 فَسَادًا اَنْ يُقَتَّلُوۡا اَوْ يُصَلَّبُوۡا اَوْ تُقَطَّعَ اَيْدِيهِمْ وَاَرْجُلُهُمْ
 مِّنۡ خِلَافٍ اَوْ يُنْفَوۡا مِنَ الْاَرْضِ ۗ ذٰلِكَ لَهُمْ خِزْيٌ فِى
 الدُّنْيَا وَلَهُمْ فِى الْاٰخِرَةِ عَذَابٌ عَظِيۡمٌ ﴿۳۳﴾

(33) તે લોકો કે જેઓ અલ્લાહ અને તેના
 રસૂલથી લડે છે તથા ભૂમિમાં ફસાદ ફેલાવવાના
 પ્રયત્ન કરે છે, તેમનો બદલો એજ છે કે તેમને
 મારી નાખવામાં આવે અથવા તેમને શૂળીએ
 ચઢાવવામાં આવે અથવા તેમના હાથ તથા પગ
 ઉલટા સુલટા કાપી નાખવામાં આવે અથવા તેમને
 દેશપાર કરવામાં આવે; આ તો તેમની આલોકની

ફજેતી છે અને પરલોકમાં તો તેમના માટે ઘણો મોટો અઝાબ છે:

إِلَّا الَّذِينَ تَابُوا مِنْ قَبْلِ أَنْ تَقْدِرُوا عَلَيْهِمْ ۗ فَاعْلَمُوا أَنَّ
اللَّهَ غَفُورٌ رَحِيمٌ ۝

(૩૪) સિવાય કે જેઓ તૌબા કરે એ પહેલાં કે તમે તેમના પર કાબૂ મેળવો, માટે તમે આ જાણી લો કે અલ્લાહ મોટો ક્ષમાવાન (અને) દયા કરનાર છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ
وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ ۝

(૩૫) અય ઇમાન લાવનારાઓ! અલ્લાહનો ભય રાખો અને તેના સુધી (પહોંચવા)નો આધાર શોધો

તથા તેના માર્ગમાં અંતઃકરણ પૂર્વક પ્રયત્ન કરો કે જેથી તમે સફળતા મેળવો.

إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُمْ مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ
مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقْبَلُ مِنْهُمْ ۗ
وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿٣٦﴾

(૩૬) બેશક જેમણે નાસ્તિકપણું ધારણ કર્યું તેઓ અગર જે કાંઈ ઝમીનમાં છે તે સઘળું તેમનું હોય અને તેટલું જ બીજું પણ તેમની પાસે હોય અને તે સઘળું કયામતના દિવસના અઝાબથી બચવા માટે બદલામાં આપવા યાહે તો પણ તેમનો એ

(બદલો) સ્વીકારવામાં આવશે નહિ, અને તેમના માટે દુઃખદાયક અઝાબ છે

يُرِيدُونَ أَنْ يُخْرِجُوا مِنَ النَّارِ وَمَا هُمْ بِمُخْرِجِينَ
مِنْهَا ۚ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ ﴿٣٤﴾

(૩૭) તેઓ આગમાંથી નીકળી (નાસી) જવાનો ઇરાદો કરશે છતાં તેઓ તેમાંથી નીકળી શકશે નહિ; અને તેમના માટે કાયમની શિક્ષા હશે.

وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جِزَاءً بِمَا كَسَبَا
نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ ﴿٣٨﴾

(૩૮) ચોરી કરનાર પુરુષ અને ચોરી કરનાર સ્ત્રી હોય તો બંનેના હાથ કાપી નાખો, આ તેમની

કરણીનો બદલો (અને) અલ્લાહ તરફથી ઘડા
(નસીહત)રૂપ શિક્ષા છે; અને અલ્લાહ ઝબરદસ્ત
હિકમતવાળો છે.

فَمَنْ تَابَ مِنْ بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوبُ عَلَيْهِ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ ﴿٣٩﴾

(૩૯) પછી જે કોઈ પોતાની સખ્તાઈ (અર્થાત
ગુનાહ ભર્યા કાર્ય) પછી પ્રશ્ચાતાપ કરે અને
(પોતાની ચાલ) સુધારે તો બેશક અલ્લાહ તેની
તૌબા સ્વીકારી લેશે; નિસંશય અલ્લાહ મોટો માફ
કરનાર (અને) દયા કરનાર છે.

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَوَاتِ وَالْأَرْضِ ط يُعَذِّبُ مَنْ
يَشَاءُ وَيَغْفِرُ لِمَنْ يَشَاءُ ط وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿٤٠﴾

(40) શું તું નથી જાણતો કે આકાશો તથા
ઝમીનની બાદશાહત અલ્લાહની જ છે ? તે જેને
ચાહે છે અઝાબ આપે છે અને જેને ચાહે છે માફ
કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ
ધરાવનાર છે.

يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ
الَّذِينَ قَالُوا آمَنَّا بِأَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِنْ قُلُوبُهُمْ ؕ وَمِنَ
الَّذِينَ هَادُوا ؕ سَمِعُوا لِكَذِبٍ سَمِعُوا لِقَوْمٍ آخَرِينَ لَمْ

يَأْتُوكَ ط يُجِرِّفُونَ الْكَلِمَ مِنْ بَعْدِ مَوَاضِعِهِ ۚ يَقُولُونَ إِنْ
 أُوتِيتُمْ هَذَا فَخُذُوهُ وَإِنْ لَمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا ط وَمَنْ يُرِدِ اللَّهُ
 فِتْنَتَهُ فَلَنْ تَمْلِكَ لَهُ مِنَ اللَّهِ شَيْئًا ط أُولَئِكَ الَّذِينَ لَمْ يُرِدِ
 اللَّهُ أَنْ يُطَهِّرْ قُلُوبَهُمْ ط لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ ۗ وَ لَهُمْ فِي
 الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ﴿٣١﴾

(૪૧) અચ રસૂલ ! જે લોકો નાસ્તિકપણું કરવામાં
 પ્રયત્ન કરે છે એ (બનાવ) તને દિલગીર કરે નહિ
 (અને) તેઓ માંના કેટલાક તો એવા છે કે જેઓ
 મુખેથી કહે છે કે અમે ઇમાન લાવ્યા છીએ. જો કે
 તેમના અંતઃકરણો ઇમાન લાવ્યા જ નથી, અને
 યહૂદીઓ માંના કેટલાક (એવા છે) કે જેઓ ખોટો

અર્થ ઉપજાવવા (ના હેતુથી) મોટા સાંભળનાર છે
(આ) સાંભળનારાઓ (જાસુસો છે) બીજી કૌમો માટે
કે જેઓ હજી તારી પાસે આવ્યા નથી; તેઓ
શબ્દોને તેના મૂળ સ્થાનેથી બદલી નાખે છે, (અને)
કહે છે કે જો તમને આ (હુકમ) આપવામાં આવે
તો તે ગ્રહણ કરી લેજો અને જો તમને તે (હુકમ)
આપવામાં ન આવે તો (તેથી) ચેતજો; અને જેને
અલ્લાહ ભુલાવામાં નાખવા યાહે તો તું હરગિઝ
અલ્લાહને ત્યાં તેના સબંધમાં કાંઈ સત્તા ધરાવતો
નથી; એજ તે લોકો છે કે જેમના અંતઃકરણોને
અલ્લાહે શુધ્ધ કરવા ઇચ્છયું નથી; દુનિયામાં

તેમના માટે ફજેતી છે અને આખેરતમાં તેમના માટે ઘણો મોટો અઝાબ છે.

سَمِعُونَ لِلْكَذِبِ أَكْثُونَ لِلصَّحْتِ ط فَإِنْ جَاءُوكَ فَاحْكُم بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ء وَإِنْ تَعْرِضْ عَنْهُمْ فَلَنْ يَضُرُّوكَ شَيْئًا ط وَإِنْ حَكَمْتَ فَاحْكُم بَيْنَهُمْ بِالْقِسْطِ ط إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ ﴿٣٢﴾

(૪૨) (તેઓ) અસત્યના મોટા સાંભળનારા (અને) હરામના મોટા ખાનારા (છે); અગર તેઓ તારી પાસે (કોઈ સવાલના નિર્ણય માટે) આવે તો તેમની વચ્ચે ફેંસલો કરી દે અથવા તો તેમની તરફથી મોઢું ફેરવી લે, અને જો તું તેમનાથી મોઢું

ફેરવી લેશે તો પણ તેઓ તારું હરગિઝ કાંઈ બગાડી શકશે નહિ; અને અગર નિરાકરણ કરે તો તેમની વચ્ચે ન્યાયસર નિરાકરણ કર; બેશક અલ્લાહ ન્યાય કરનારાઓને દોસ્ત રાખે છે.

وَ كَيْفَ يُحْكِمُونَكَ وَعِنْدَهُمُ التَّوْرَةُ فِيهَا حُكْمُ اللَّهِ ثُمَّ
يَتَوَلَّوْنَ مِنْ بَعْدِ ذَلِكَ وَمَا أُولَئِكَ بِالْمُؤْمِنِينَ ﴿٤٣﴾

(૪૩) અને આ લોકો તને કેવી રીતે સરપંચ બનાવે જ્યારે કે તેમની પાસે તૌરેત (મોજૂદ) છે, જેમાં અલ્લાહનો (દરેક બાબતનો) નિર્ણય છે; તે છતાં (તેનાથી) પણ મોઢું ફેરવી લે છે, અને તેઓ (તૌરેતને પણ) માનતા નથી.

إِنَّا أَنْزَلْنَا التَّوْرَةَ فِيهَا هُدًى وَنُورٌ ۖ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ
 الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبُّنِيُّونَ وَالْأَحْبَارُ بِمَا
 اسْتُحْفِظُوا مِنْ كِتَابِ اللَّهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۗ فَلَا تَخْشَوُا
 النَّاسَ وَاخْشَوْنِي وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۗ وَمَنْ لَمْ
 يَحْكَمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَئِكَ هُمُ الْكٰفِرُونَ ﴿٣٣﴾

(૪૪) બેશક અમોએ તૌરેત ઉતારી છે જેમાં
 હિદાયત તથા નુર છે; તે નબીઓ કે જે અલ્લાહના
 આજ્ઞાંકિત હતા તેઓ યહૂદીઓ માટે ફેંસલા એજ
 (તૌરેતના હુકમો) પ્રમાણે કરતા હતા એવીજ રીતે
 અલ્લાહવાળા લોકો અને આલિમો પણ, કારણ કે
 તેમને અલ્લાહની કિતાબમાંથી (કેટલાક ભાગના)

રક્ષક ઠરાવવામાં આવ્યા હતા અને તેઓ તેના સાક્ષી હતા; માટે તમે લોકોથી ભય ન પામો પણ મારો જ ભય રાખો અને મારી આયતોના બદલામાં નજીવી કિંમત મેળવો નહિ; અને જે લોકો અલ્લાહે જે ઉતાર્યું છે તે પ્રમાણે નિર્ણય ન કરે તો તેઓજ નાસ્તિકો છે.

وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ ۖ وَالْعَيْنَ بِالْعَيْنِ
وَالْأَنْفَ بِالْأَنْفِ وَالْأُذْنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ ۖ وَالْجُرُوحَ
قِصَاصٌ ۗ فَمَنْ تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۗ وَمَنْ لَّمْ يَحْكَمْ بِمَا
أَنْزَلَ اللَّهُ فَأُولَئِكَ هُمُ الظَّالِمُونَ ﴿٣٥﴾

(૪૫) અને અમોએ પ્રાણના બદલે પ્રાણ તથા આંખના બદલે આંખ તથા નાકના બદલે નાક તથા કાનના બદલે કાન અને દાંતના બદલે દાંત અને એવીજ રીતે દરેક જખ્મનો બદલો હોય એવું તેમના પર તે (પુસ્તક તૌરેત)માં વાજિબ કરી દીધું હતું; પછી જે કોઈ માફ કરી દે તો તે તેના પોતાના ગુનાહોનો કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જશે; અને જેઓ અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તે પ્રમાણે ન્યાય ન કરે તો તેઓજ અન્યાયીઓ છે.

وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَةِ ۖ وَآتَيْنَاهُ الْإِنجِيلَ فِيهِ هُدًى وَنُورٌ ۝

وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَةِ وَهُدًى وَمَوْعِظَةً
لِّلْمُتَّقِينَ ﴿٣٦﴾

(૪૬) અને એજ નબીઓના પગલે પગલે ચાલવા અમોએ મરિયમના પુત્ર ઇસાને મોકલ્યો જે પોતાની પહેલાંની તૌરેતની સત્યતા સ્વીકારતો હતો, અને તેને અમોએ ઇજ્જલ આપી જેમાં હિદાયત હતી અને નૂર પણ, અને તે તેની પહેલાંની તૌરેતની સચ્ચાઇનું સમર્થન કરનારી પણ હતી અને પરહેઝગારો માટે હિદાયત તથા નસીહત હતી.

وَلِيَحْكُمَ أَهْلَ الْإِنجِيلِ بِمَا أَنْزَلَ اللَّهُ فِيهِ ۖ وَمَنْ لَمْ يَحْكَمْ
بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَئِكَ هُمُ الْفَاسِقُونَ ﴿٤٩﴾

(૪૭) અને ઇસ્જલવાળાઓને લાઝિમ છે કે
અલ્લાહે તે (ઇસ્જલ)માં જે ઉતાર્યું છે તે પ્રમાણે
નિર્ણય કરે; અને જેઓ અલ્લાહે ઉતારેલા (હુકમ)
મુજબ નિર્ણય ન કરે તો તેઓજ નાફરમાન છે.

وَأَنْزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنْ
الْكِتَابِ وَمُهَيِّبًا عَلَيْهِ فَاحْكُم بَيْنَهُمْ بِمَا أَنْزَلَ اللَّهُ وَلَا
تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلِّ جَعَلْنَا مِنْكُمْ
شِرْعَةً وَمِنْهَا جَا ۙ وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَكِنْ

لِيَبْلُوكُمْ فِي مَا اتَّكُمُ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ إِلَى اللَّهِ
مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ ﴿٨٧﴾

(૪૮) અને (અથ રસૂલ !) અમોએ તારા ઉપર આ કિતાબ (કુરઆન) સત્યતાપૂર્વક ઉતારી છે, જે તેની અગાઉની કિતાબોની સચ્યાઈ (નું સમર્થન) કરનારી છે તથા તેમનું રક્ષણ કરનારી પણ છે, માટે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તે મુજબ તેમની વચ્ચે ન્યાય કર અને જે સત્ય તારી પાસે આવી ચૂક્યું છે તેની અવગણના કરીને તેમની ઇચ્છાઓને અનુસર નહિ. તમારામાંથી દરેકને માટે અમોએ એક શરીઅત (ધર્મ-નિયમ) તથા સ્પષ્ટ તરીકો (પદ્ધતિ) નક્કી કરી દીધી છે અને જો

અલ્લાહ યાહતે તો તમને એકજ શરીઅતવાળી ઉમ્મત બનાવી દેતે, પરંતુ (તેમ ન કરવાનું કારણ) તેણે તમને જે કાંઈ આપ્યું છે તેમાં તમને અજમાવે, માટે નેકી કરવામાં એક બીજાથી હરીફાઈ કરો; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી તે જે વાતમાં તમે મતભેદ કરતા હતા તે તમને જણાવી દેશે:

وَأَنِ احْكُم بَيْنَهُم بِمَا أَنْزَلَ اللَّهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ
 وَاحْذَرْهُمْ أَنْ يَفْتِنُوكَ عَنْ بَعْضِ مَا أَنْزَلَ اللَّهُ إِلَيْكَ ۗ فَإِنْ
 تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّهُ أَنْ يُصِيبَهُمْ بِبَعْضِ ذُنُوبِهِمْ ۗ
 وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ لَفَاسِقُونَ ﴿٣٩﴾

(૪૯) અને એ કે અલ્લાહે જે (હુકમ) ઉતાર્યો છે તેજ પ્રમાણે તેમની વચ્ચે ન્યાય કર, અને તેમની ખોટી ઇચ્છાઓને અનુસર નહિ અને તેમનાથી આ વાતની સાવચેતી રાખ કે જે કાંઈ અલ્લાહે ઉતાર્યું છે તેના કોઈ ભાગથી તેઓ તને બહેકાવે નહિ; પછી જો તેઓ મોંઢું ફેરવે તો તું જાણી લે કે અલ્લાહ એવુંજ ચાહે છે કે તેમને તેમના કેટલાક ગુનાહોના કારણે (અઝાબમાં) સપડાવી દે; અને નિઃસંશય લોકોમાંથી ઘણા ખરા નાફરમાન છે.

أَفْحَكَمَ الْجَاهِلِيَّةِ يَبْغُونَ ط وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ حُكْمًا لِقَوْمٍ

يُوقِنُونَ ٥٠

(૫૦) તો શું તેઓ (આજે પણ) અજ્ઞાનતાના કાળના ન્યાયની ઇચ્છા રાખે છે ? અને સંપૂર્ણ વિશ્વાસ રાખનારાઓ માટે અલ્લાહ કરતાં બેહતર ફેંસલો કરનાર કોણ છે ?

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْيَهُودَ وَالنَّصَارَىٰ أَوْلِيَاءَ ۚ
بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَمَنْ يَتَوَلَّهُمْ مِنكُمْ فَإِنَّهُ مِنْهُمْ ۗ ط

إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ﴿٥١﴾

(૫૧) અય ઇમાન લાવનારાઓ! યહૂદી તથા નસારાઓને મિત્ર બનાવો નહિ; તેઓ માંના (દરેક) એકબીજાના મિત્ર છે; અને તમારામાંથી જે કોઈ તેમને મિત્ર બનાવશે તો નિસંશય તે તેઓ માંહેનો

છે; બેશક અલ્લાહ ઝુલ્મગાર કોમને માર્ગ દેખાડતો નથી.

فَتَرَى الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ يُسَارِعُونَ فِيهِمْ يَقُولُونَ
نَحْشَى أَنْ تُصِيبَنَا دَائِرَةٌ ۗ فَعَسَى اللَّهُ أَنْ يَأْتِيَ بِالْفَتْحِ أَوْ أَمْرٍ
مِّنْ عِنْدِهِ فَيُصْبِحُوا عَلَىٰ مَا أَسْرُوا فِي أَنْفُسِهِمْ نَادِمِينَ ﴿٥٢﴾

(૫૨) પછી તે લોકો કે જેમના અંતઃકરણોમાં રોગ છે તેમને તું જોશે કે તે (ચહૂદીઓ તથા ખ્રિસ્તિ)ઓની દોસ્તી કરવામાં ઘણીજ ઉતાવળ કરે છે (અને) કહે છે કે અમે પાછા કોઈ મુસીબતમાં આવી ન જઈએ તે માટે ડરીએ છીએ; માટે પાસે છે કે અલ્લાહ વિજય અથવા બીજો કોઈ હુકમ

પોતાના તરફથી જાહેર કરે કે જેથી તે (મુનાફીકો) જે કાંઈ પોતાના અંતઃકરણોમાં સંતાડી રહ્યા છે તે માટે પસ્તાવામાં પડે.

وَيَقُولُ الَّذِينَ آمَنُوا أَهَؤُلَاءِ الَّذِينَ أَقْسَمُوا بِاللَّهِ جَهْدَ
 أَيْمَانِهِمْ ۖ إِنَّهُمْ لَمَعَكُمْ ۗ حَبِطَتْ أَعْمَالُهُمْ فَأَصْبَحُوا
 خَسِرِينَ ﴿٥٣﴾

(૫૩) અને તે વેળા ઇમાન લાવનારાઓ કહેશે કે શું આ તેઓજ છે કે જેઓ અલ્લાહની સખતમાં સખત સોગંદો ખાતા હતા કે જરૂર તેઓ તમારી સાથે હતા ! તેમના કર્મો રદ થઈ જશે, જેથી તેઓ હાનિ ભોગવનારા થઈ જશે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَنْ يَرْتَدَّ مِنْكُمْ عَنْ دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ
 بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ ۖ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى
 الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ ۗ
 ذَلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ ﴿٥٣﴾

(૫૪) અથ ઇમાન લાવનારાઓ ! તમારામાં જે
 કોઈ પોતાના ધર્મથી ફરી જશે તો (તેઓ અલ્લાહનું
 કાંઈજ બગાડશે નહિ) અલ્લાહ નઝદીકમાં એવા
 લોકોને લાવી હાજર કરશે કે જેમને તે દોસ્ત
 રાખતો હશે અને તેઓ તેને દોસ્ત રાખતા હશે,
 મોઅમીનો તરફ તેઓ નમ્ર હશે (અને) ઇમાન નહિ
 લાવનારાઓ તરફ સખત; અલ્લાહની રાહમાં
 જેહાદ કરે એવા અને કોઈ ઠપકો આપનારના

ઠપકાથી ન ડરે એવા; આ અલ્લાહની કૃપા છે જેને
ચાહે આપે છે અને અલ્લાહ વિશાળ જ્ઞાનનો સાહેબ
છે.

إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ
الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ ﴿٥٥﴾

(૫૫) (અચ ઇમાનદારો !) તમારા રક્ષક અલ્લાહ
અને તેના રસૂલના સિવાય કોઈ નથી અને તે
લોકો પણ કે જેઓ ઇમાન લાવ્યા છે અને જેઓ
નમાઝ કાયમ કરે છે તથા રૂકુઅની સ્થિતિમાં
ઝકાત આપે છે.

وَمَنْ يَتَوَلَّ اللَّهَ وَرَسُولَهُ وَالَّذِينَ آمَنُوا فَإِنَّ حِزْبَ اللَّهِ هُمُ
الْغَالِبُونَ ﴿٥٦﴾

(૫૬) અને જે અલ્લાહ તથા તેના રસૂલને તથા મોઅમીનોને મિત્ર બનાવશે (તે અલ્લાહ વાળાઓના ટોળામાં દાખલ છે) અને ખરેખર અલ્લાહના પક્ષવાળા જ હંમેશા વિજયી રહેશે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الَّذِينَ اتَّخَذُوا دِينَكُمْ هُزُؤًا
وَلَعِبًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَالْكَفَّارَ
أَوْلِيَاءَ ۗ وَاتَّقُوا اللَّهَ إِنَّ كُنْتُمْ مُؤْمِنِينَ ﴿٥٧﴾

(૫૭) અય ઇમાન લાવનારાઓ ! તે લોકો કે જેમને તમારી પહેલાં કિતાબ આપવામાં આવી છે તેઓ

માંના જે લોકો તમારા ધર્મને હાંસી અને રમકડું ગણે છે તેમને તથા નાસ્તિકોને દોસ્ત બનાવો નહિ; અને જો તમે મોઅમીન હો તો અલ્લાહથી ડરતા રહો.

وَإِذَا نَادَيْتُمْ إِلَى الصَّلَاةِ اتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ
قَوْمٌ لَّا يَعْقِلُونَ ﴿٥٨﴾

(૫૮) અને જ્યારે તમે (અઝાન દઇ) નમાઝ માટે બોલાવો છો ત્યારે તેની પણ ઠણ મશ્કરી કરે છે; આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ સમજ ધરાવતા નથી.

قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنْقِبُونَ مِنِّي إِلَّا أَنْ أَمِنَّا بِاللَّهِ وَمَا
أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ مِن قَبْلُ ۖ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ ﴿٥٩﴾

(૫૯) તું કહે કે અય કિતાબવાળાઓ ! શું તમે એ
કારણે અમારામાં એબ કાઢો છે કે અમે અલ્લાહ
પર તથા જે કાંઈ અમારા પર ઉતારવામાં આવ્યું
છે તેના પર તથા જે કાંઈ (અમારી) પહેલાં
ઉતારવામાં આવ્યું છે તેના પર ઇમાન લાવ્યા
છીએ? પણ (વાત એ છે કે) તમારામાંના ઘણાં
ખરા નાફરમાન છે (તેથી અમે તમારી આંખોમાં
ખટકીએ છીએ).

قُلْ هَلْ أَنْبِئُكُمْ بِشَرٍّ مِّنْ ذَلِكَ مَثُوبَةً عِنْدَ اللَّهِ ط مَنْ لَعَنَهُ
 اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمْ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ
 الطَّاغُوتَ ط أُولَئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَنِ السَّبِيلِ ⑥

(50) (અથ રસૂલ !) તું કહે કે શું હું તમને તેમની
 ખબર આપું કે જેમના માટે અલ્લાહ તરફથી આ
 કરતાંય વધારે ખરાબ બદલા રૂપી સજા નક્કી થઈ
 ચૂકી છે ? તેઓ (એ છે કે) જેમના પર અલ્લાહે
 ફિટકાર કરી તથા જેમના પર ક્રોધ ઉતાર્યો અને
 તેઓ માંના કેટલાકને વાંદરા તથા સુવ્વરો
 બનાવ્યા અને તેઓ માંના કેટલાક શેતાનના
 સેવકો બન્યા; એજ લોકો છે કે જેઓ દરજ્જાની

રૂએ ઘણાજ ખરાબ છે અને સન્માર્ગથી સૌ કરતાં વધારે ભટકી ગયેલા છે.

وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَدْ دَخَلُوا بِالْكَفْرِ وَهُمْ قَدْ

خَرَجُوا بِهِ^ط وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ ﴿١١﴾

(૬૧) અને જે વેળા તેઓ તમારી પાસે આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે તો ઇમાન લાવ્યા છીએ પણ વાસ્તવમાં તો તેઓ નાસ્તિકપણા સાથે આવે છે અને તે (નાસ્તિકપણા)ની સાથે નીકળી (ચાલ્યા) જાય છે; અને જે (દ્વેષભાવ) તેઓ સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે.

وَتَرَى كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ
السُّحْتِ ۖ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ ﴿٣٢﴾

(૬૨) અને તું તેઓમાંથી ઘણાઓને એવી હાલતમાં જોશે કે ગુનાહ અને અત્યાચાર કરવામાં અને હરામનો માલ ખાવામાં એક બીજાની સાથે હરીફાઈ કરે છે; ખરેખર તેઓ જે કાંઈ કરે છે તે ઘણું જ ખરાબ કરે છે.

لَوْلَا يَنْهَاهُمُ الرَّبُّنِيُّونَ وَالْأَحْبَارُ عَنْ قَوْلِهِمُ الْإِثْمَ
وَأَكْلِهِمُ السُّحْتِ ۖ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ ﴿٣٣﴾

(૬૩) અલ્લાહવાળા લોકો તથા વિદ્વાનો તેમને ગુનાહભરી વાત કહેતાં તથા હરામનો માલ ખાતાં

શા માટે અટકાવતા નથી ? ખરેખર તેઓ જે કાંઈ કરે છે તે ઘણું જ દુષ્ટ કાર્ય કરે છે.

وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۖ غُلَّتْ أَيْدِيهِمْ وَلِعِنَّا بِمَا
قَالُوا لَبَلٌ يَدُهُ مَبْسُوطَةٌ ۖ يُنْفِقُ كَيْفَ يَشَاءُ ۖ وَلِيَزِيدَنَّ
كَثِيرًا مِّنْهُمْ مَّا أُنزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ
وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَى يَوْمِ الْقِيَامَةِ ۖ كُلَّمَا
أَوْقَدُوا نَارًا لِلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۖ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ
فَسَادًا ۖ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ ﴿٦٤﴾

(૬૪) અને વહુદીઓ કહે છે કે અલ્લાહનો હાથ બંધાયેલો છે; (૫૯) તેમનાજ હાથ બંધાઈ જાય!

અને તેમના પર આ (કહેવા)ના કારણે લાનત થઈ, બલકે તે (અલ્લાહ)ના તો બંને હાથ ફેલાયેલા છે, જેવી રીતે યાહે છે અર્પણ કરે છે અને જે કાંઈ તારા પરવરદિગાર તરફથી તારા પર ઉતારવામાં આવ્યું છે તે તેઓ માંના ઘણાઓની ઉધ્ધતાઈ તથા નાસ્તિકપણાને અવશ્ય વધારી મૂકશે; અને અમોએ તેમની વચ્ચે કયામત સુધી શત્રુતા અને સખ્ત કીન્નાખોરી નાખી દીધાં છે; જ્યારે જ્યારે તેઓ લડાઈની આગ સળગાવે છે ત્યારે ત્યારે અલ્લાહ તેને હોલવી નાખે છે અને તેઓ ભૂમિમાં ફસાઈ ફેલાવવાનો પ્રયત્ન કરે છે; અને અલ્લાહ ફસાઈ કરનારાઓને દોસ્ત રાખતો નથી.

وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ
وَلَا دَخَلْنَاهُمْ جَنَّةِ النَّعِيمِ ﴿٦٥﴾

(૬૫) અને જો ક્રિતાબ ધરાવનારાઓ ઇમાન લાવતે તથા પરહેઝગાર બનતે તો અમે તેમના ગુનાહ નાબૂદ કરી નાખતે અને તેમને નેઅમતવાળી જન્નતોમાં દાખલ કરતે.

وَلَوْ أَنَّهُمْ أَقَامُوا التَّوْرَةَ وَالْإِنْجِيلَ وَمَا أُنزِلَ إِلَيْهِمْ مِنْ
رَبِّهِمْ لَأَكَلُوا مِنْ فَوْقِهِمْ وَمِنْ تَحْتِ أَرْجُلِهِمْ ۗ مِنْهُمْ أُمَّةٌ
مُقْتَصِدَةٌ ۗ وَكَثِيرٌ مِنْهُمْ سَاءَ مَا يَعْمَلُونَ ﴿٦٦﴾

(૬૬) અને જો તેઓ તૌરેત તથા ઇન્જીલને તથા જે કાંઈ (સહીશ) તેમના પરવરદિગાર તરફથી

તેમના ઉપર ઉતારવામાં આવ્યા હતા તે (ની આજ્ઞાઓ) કાયમ રાખતે તો તેઓ આસમાન (પર)ની રોઝી પણ ખાતે તથા ઝમીનની પણ; તેઓ માંહેનું એક ટોળું મધ્યમ રીતે ચાલનારું છે; અને તેઓ માંના ઘણાં ખરા જે કૃત્યો કરે છે તે દુષ્ટ છે.

يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ ^ط وَإِنْ لَمْ تَفْعَلْ
 فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ^ط وَاللَّهُ يَعْصِبُكَ مِنَ النَّاسِ ^ط إِنَّ اللَّهَ لَا
 يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ①

(૬૭) અય રસૂલ! જે કાંઈ તારા પરવરદિગાર તરફથી તારી તરફ ઉતારવામાં આવ્યું છે તે

(લોકો સુધી) પહોંચાડી દે; અને જો તેં તેમ ન કર્યું તો જાણે તેં તેનો (કોઈ પણ) સંદેશો પહોંચાડ્યો જ નહિ; અને અલ્લાહ તને લોકો(ના ત્રાસ)થી સુરક્ષિત રાખશે; નિસંશય અલ્લાહ ઇન્કાર કરનારી કૌમની હિદાયત કરતો નથી.

قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُتَيَّمُوا بِاللَّيْلَةِ
 وَالْإِنْجِيلِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ ط وَلَا يَزِيدَنَّ كَثِيرًا
 مِنْهُمْ مَّا أُنزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ طُغْيَانًا وَكُفْرًا ء فَلَا تَأْسَ
 عَلَى الْقَوْمِ الْكَافِرِينَ ﴿٩٨﴾

(૬૮) (અથ રસૂલ !) તું કહે કે અથ
 ક્રિતાબવાળાઓ! જ્યાં સુધી તમે તૌરેત તથા

ઇજ્જલ તથા જે કાંઇ તમારા પરવરદિગાર
તરફથી તમારા પર ઉતારવામાં આવ્યું છે તેને
કાયમ નહિ રાખો ત્યાં સુધી તમે કોઇ પણ મુદ્દા
(ખરા ધર્મ) પર નથીજ; અને (અય રસૂલ!) જે કાંઇ
તારા પરવરદિગાર તરફથી તારા પર ઉતારવામાં
આવ્યું છે તે તે (લોકો) માંના ઘણાઓની ઉધ્ધતાઇ
તથા નાસ્તિકપણાને અવશ્ય વધારી મૂકશે, માટે
ઇમાન નહિ લાવનારા લોકોની દશા પર કાંઇ
અફસોસ કરતો નહિ.

إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّبُؤْنَ وَالنَّظْرِي مَنْ
آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا
هُمْ يَحْزَنُونَ ﴿٦٩﴾

(૬૯) નિ:સંશય જેઓ ઇમાન લાવ્યા છે અને જેઓ
યહૂદીઓ અને સાબેઇન (સિતારાને પૂજનારા) અને
ખ્રિસ્તિઓ છે, જે કોઇ અલ્લાહ તથા કયામતના
દિવસ પર ઇમાન લાવશે તથા સત્કાર્યો કરશે તો
તેમને ન તો કાંઇ ભય રહેશે અને ન તો તેઓ
ઉદાસ થશે.

لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَارْسَلْنَا إِلَيْهِمْ رَسُولًا
 كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَى أَنْفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا
 وَفَرِيقًا يَقْتُلُونَ ﴿٩٠﴾

(90) ખરેજ અમોએ બની ઇસરાઇલ પાસેથી વચન લીધું હતું અને તેમની તરફ રસૂલો મોકલ્યા હતા; જ્યારે જ્યારે તેમની પાસે કોઈ એવો રસૂલ (અલ્લાહનો) હુકમ લઈને આવ્યો કે જેને તેમનું મન પસંદ કરતું ન હતું ત્યારે તેમણે કેટલાકને જૂઠલાવ્યા તો કેટલાકને મારી નાખ્યા.

وَحَسِبُوا إِلَّا تَكُونُ فِتْنَةً فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّهُ عَلَيْهِمْ
 ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرًا مِنْهُمْ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ﴿٩١﴾

(૭૧) અને તેમણે એવું ગુમાન કર્યું હતું કે (તેમ કરવા)થી કાંઈ મુસીબત આવશે નહિ, જેથી તેઓ આંધળા અને બહેરા થઈ ગયા; પછી અલ્લાહે તેમની તૌબા કબૂલ કરી લીધી, પછી પણ તેઓ માંના ઘણાં આંધળા તથા બહેરા થઈ ગયા; અને તેઓ જે કાંઈ કરે છે તે અલ્લાહ નિહાળનાર છે.

لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ط وَقَالَ
 الْمَسِيحُ يَبْنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ط إِنَّهُ مَنْ
 يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ط وَمَا
 لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ ﴿٤٢﴾

(૭૨) ખરેખર તે લોકોએ નાસ્તિકપણું કર્યું જેઓ કહે છે કે બેશક અલ્લાહ એજ મરિયમનો પુત્ર મસીહ છે; જોકે મસીહે (પોતેજ) કહ્યું હતું કે બની ઇસરાઇલ! અલ્લાહની ઇબાદત કરો જે મારો પરવરદિગાર છે અને તમારો પણ; બેશક અલ્લાહની સાથે કોઈને શરીક કરશે તેના પર અલ્લાહે જન્મત હરામ કરી દીધી છે અને તેનું ઠેકાણું અગ્નિ છે; અને ઝુલમગારોનો કોઈ મદદગાર થશે નહિ.

لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ وَمَا مِنْ إِلَهٍ إِلَّا
 إِلَهٌ وَاحِدٌ وَإِنْ لَمْ يَنْتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ
 كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿٤٣﴾

(93) ખરેખર તે લોકો નાસ્તિક થઇ ગયા કે જેમણે
 કહ્યું કે નિ:સંશય અલ્લાહ ત્રણ (ખુદા) માંહેનો ત્રીજો
 (ખુદા) છે, જો કે એકજ માઅબૂદ સિવાય અન્ય
 કોઇ માઅબૂદ નથી; અને જે કાંઇ તેઓ કહે છે
 તેનાથી જો તેઓ અટકશે નહિ તો તેઓમાંથી જે
 ઇમાન ન લાવશે તેમને ખરેખર દુ:ખદાયક
 અઝાબ મળશે.

أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَ لَهُ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ ﴿٤٤﴾

(૭૪) તેઓ અલ્લાહની તરફ કેમ રજૂ નથી થતાં તથા તેનાથી ક્ષમા કેમ નથી માંગતા ? જો કે અલ્લાહ મોટો ક્ષમાવાન (અને) દયા કરનાર છે.

مَا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ ؕ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ
الرُّسُلُ ؕ وَأُمُّهُ صِدِّيقَةٌ ؕ كَانَا يَأْكُلَنِ الطَّعَامَ ؕ أَنْظُرْ كَيْفَ
نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ أَنْظُرْ أَنَّى يُؤْفَكُونَ ﴿٥٤﴾

(૭૫) મરિયમનો પુત્ર મસીહ બીજો કોઈ નથી પણ એક રસૂલ છે, જેની અગાઉ ઘણાય રસૂલો થઈ ગયા છે; અને તેની મા (મરિયમ) મહાન સત્ય બોલનારી હતી; બંને ખાવાનું પણ આરોગતા હતા; (હવે) વિચાર કરે કે અમે તેમના માટે (અમારી)

નિશાનીઓ કેટલી સ્પષ્ટ કરીને વર્ણવીએ છીએ
છતાં પણ જો કે તેઓ કેવી રીતે બહેકી ચાલ્યા
જાય છે !

قُلْ أَتَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا
وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ﴿٦٦﴾

(૭૬) (અય રસૂલ !) તું કહે કે શું તમે અલ્લાહને
છોડી તે વસ્તુઓની ઇબાદત કરો છો કે જે તમારા
નુકસાન કે લાભ ઉપર મુદ્દલ અધિકાર ધરાવતી
નથી? અને અલ્લાહ મહાન સાંભળનાર (અને)
જાણનાર છે.

قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا
 أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِنْ قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَنْ
 سَوَاءِ السَّبِيلِ ۝

(૭૭) (અય રસૂલ!) તું કહે, અય કિતાબવાળાઓ તમારા દીનમાં નાહક અતિશયોક્તિ ન કરો તથા તે કૌમની ખાહેશો (ઇચ્છાઓ)ને ન અનુસરો કે જે આ પહેલાં ગુમરાહ થઇ ચૂકી છે, અને (સાથેજ બીજા) ઘણાઓને ગુમરાહ બનાવ્યા છે અને સન્માર્ગથી ભટકી ગઇ છે.

لُعِنَ الَّذِينَ كَفَرُوا مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَى لِسَانِ دَاوُدَ
 وَعِيسَى ابْنِ مَرْيَمَ ۗ ذَلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ ۝

(૭૮) બની ઇસરાઇલમાંથી જેઓ ઇમાન ન લાવ્યા તેમના ઉપર દાઉદ તથા મરિયમના પુત્ર ઇસાના મુખેથી લાઅનત કરવામાં આવી; તે એ માટે કે તેઓ નાફરમાની તથા અત્યાચાર કરતા હતા.

كَانُوا لَا يَتَنَاهَوْنَ عَنْ مُنْكَرٍ فَعَلُوهُ ۗ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ ﴿٧٩﴾

(૭૯) જે બદી તેઓ કરતા હતા તેનાથી એક બીજાને તેઓ અટકાવતા ન હતા; (અને) ખરેખર તેઓ જે કાંઈ કરતા હતા તે ઘણુંજ ખરાબ હતું.

تَرَى كَثِيرًا مِنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۗ لَبِئْسَ مَا
 قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَنْ سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ
 هُمْ خَالِدُونَ ﴿٨٠﴾

(૮૦) તેઓમાંથી ઘણા લોકોને તું નાસ્તિકોના મિત્ર
 બનતા જોશે; અને જે (વસ્તુઓ) તેમના
 આત્માઓએ તેમના માટે આગળ મોકલી છે તે
 ખરેખર બૂરી છે કે (જેથી) અલ્લાહ તેમનાથી
 નારાજ થયો અને તેઓ અઝાબમાં હંમેશ માટે
 રહેનાર છે.

وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوا هُمْ
 أَوْلِيَاءَ وَلَكِنَّ كَثِيرًا مِنْهُمْ فَسِقُونَ ﴿٨١﴾

(૮૧) અને જો તેઓ અલ્લાહ પર તથા તેના નબી પર તથા જે કાંઈ તેના પર ઉતારવામાં આવ્યું છે તેના પર ઇમાન લાવ્યા હોત તો તેમને મિત્ર બનાવતે નહિ, પરંતુ તેઓ માંના ઘણા ખરા નાફરમાન છે.

لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ
 أَشْرَكُوا ۗ وَلَتَجِدَنَّ أَقْرَبَهُمْ مَوَدَّةً لِلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا
 إِنَّا نَحْنُ مُسْلِمُونَ ۗ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِيَسِينَ وَرُهَبَانًا وَأَنَّهُمْ لَا
 يَسْتَكْبِرُونَ ﴿٨٢﴾

(૮૨) (અથ રસૂલ !) મોઅમીનોના સૌથી કઠર શત્રુ તું યહુદીઓ તથા મુશરીકોને જોશે, અને તેઓમાંથી

મોઅમીનોના વધારે મિત્રો તે લોકોને જોશે કે જેઓ કહે છે કે અમે ખ્રિસ્તી છીએ; આ એ માટે કે તેઓ માંના કેટલાક વિદ્વાનો છે તથા કેટલાક દુરવેશો (સંસાર ત્યાગી) છે અને (વળી) આ કે તેઓ અભિમાન કરતા નથી.